

પરીપત્ર

તા.૨-૯-૦૪ નાં નોટીફિકેશનથી મંજૂર થયેલ પુનરાવર્તિત વિકાસ નિયંત્રણના મૂળ નિયમોના ઝોનીંગ એન્ડ યુઝ પ્રોવિઝન્સને લગતા નિયમ-૩૧ ના યુઝ ઝોન ટેબલમાં ક્રમાંક-૩ નાં કોલમ-૫ મુજબ ગામતળ વિસ્તારમાં પેટ્રોલપંપ/ ફીલીંગ સ્ટેશનનો વિકાસ મળવાપાત્ર થતો ન હતો. પરંતુ રાજ્ય સરકારે ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૧૮(૧) હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૧૦-૧૧-૦૬ ના નોટીફિકેશન નં. જી.એચ/વી/૨૯૫ ઓફ ૨૦૦૬/ડીવીપી-૧૪૦૫-૩૯૫૭-૯ થી, મંજૂર થયેલ વિકાસ નિયંત્રણ નિયમોના ઝોનીંગ એન્ડ યુઝ પ્રોવિઝન્સને લગતા નિયમ-૩૧ માં સુધારો સુચવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જેની નકલ આ સાથે સામેલ છે. જે મુજબ સદરહુ નિયમ -૩૧ નાં યુઝ ઝોન ટેબલના ક્રમાંક-૩ ના કોલમ-૫ માં રીમાર્ક્સના કોલમમાં ૧૮.૦ મી કે તેથી વધુ પહોળાઈના રસ્તાઓ પર પેટ્રોલપમ્પ, ફીલીંગ સ્ટેશન કે ફીલીંગ-કમ-સર્વિસ સ્ટેશન અને સી.એન.જી ફીલીંગ સ્ટેશનની પરવાનગી આપી શકાશે તેવી જોગવાઈ થયેલ છે, જેનો અમલ કરવા આથી જણાવવામાં આવે છે.

બિડાણ :- ઉપર મુજબ તા.૧૦-૧૧-૦૬ ના નોટીફિકેશનની નકલ

નં.ટી.ડી.ઓ/ ૩૪૪૬  
તા.૨૩/૦૨/૨૦૦૭

ડાયરેક્ટર ઓફ પ્લાનીંગ  
સુરત મહાનગરપાલિકા  
૨૩/૨

- નકલ સા.રવાના :- મા.કમિશનરશ્રી પ્રતિ.. જાણ માટે. *DC*
- નકલ સ.રવાના :- તમામ ઝોનના વિભાગીય વડાશ્રીઓ પ્રતિ.. જાણ માટે.
- નકલ રવાના :- શહેર વિકાસ અધિકારીશ્રી પ્રતિ... જાણ તથા અમલ માટે.
- નકલ રવાના :- તમામ ઝોનલ અધિકારીશ્રીઓ / કાર્યપાલક ઈજનેરશ્રીઓ પ્રતિ...જાણ તથા અમલ માટે.

8  
79

20 NOV 2006

GOVERNMENT OF GUJARAT  
URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT  
SACHIVALAYA, GANDHINAGAR

NOTIFICATION

Dated : 10-11-2006

MC/SMC  
17 NOV 2006

DUP

THE GUJARAT TOWN PLANNING AND URBAN DEVELOPMENT ACT, 1976.

F.D.O. No. 3648  
Dated 12/11/06

NO.GH /V/295 of 2006/DVP-1405-3957-L : WHEREAS, the Government of Gujarat was of the opinion that it was necessary, in the public interest, to make variations in the Final Revised Development Plan of Surat Urban Development Authority sanctioned under Government Notification, Urban Development and Urban Housing Department No.GH/V/100 of 2004/DVP-1403-3307-L, dated 02-09-2004 (hereinafter referred to as " the said Authority " and " the said Development Plan " )

AND WHEREAS, the variations proposed to be made in the said Development Plan were published, as required by the Section 19(1) of the Gujarat Town Planning and Urban Development Act, 1976 (President's Act No. 27 of 1976 ) (hereinafter referred as to " the said Act " ), in the Gujarat Government extra ordinary Gazette Part IV-B dated 27-06-2006 on page no.214-1 and 214-2 under Government Notification, Urban Development and Urban Housing Department No. GH / V/178 of 2006/DVP-142005-3957-L dated 27-06-2006 along with a notice calling upon any person to submit suggestions or objections, if any, with respect to the proposed variations to the Principal Secretary to the Government of Gujarat, Urban Development and Urban Housing Department, Sachivalaya, Block No. 14, 9<sup>th</sup> Floor, Gandhinagar, in writing, within a period of two months from the date of publication of this notification in the official gazette.

AND WHEREAS, the Government of Gujarat has not received any suggestion or objection.

AND WHEREAS, the Government of Gujarat has consulted the Surat Urban Development Authority.

NOW THEREFORE, in exercise of the powers conferred by the section 19 of the said Act. The Government of Gujarat hereby :-

- (a) sanctions the said variation to be made in the said Development Plan, as set out in Schedule appended here to and ;
- (b) specifies that the variations so set out shall come into force from dtd.10-11-2006.

SCHEDULE

Variations in the Final Revised Development Plan of the said Authority sanctioned by Government Notification, Urban Development and Urban Housing Department No. GH/V/100 of 2004/DVP-1403-3307-L, dated 02-09-2004.

Following variations are proposed in the sanction General Development Control Regulations of Surat Urban Development Authority under section 12(2)(m) of the said Act.

- (1) In regulation 31 zoning and use provisions, table at sr.no.3, in Column No. 05 words "Petrol pump, filling station or filling cum service station" are deleted.
- (2) In regulation No. 31 zoning and use provisions, use zone table at Sr. No. 3, in Column No. 06 the words and figures " Petrol pump, Filling Station or Filling cum Service Station and CNG filling station are permitted on 13.00 mt wide road or more then 18.00 mt. wide road " are added after words "Less than 7.5 mts "

At the  
Sanjay Patel  
TBO  
20/11  
2011

By order and in the name of the Governor of Gujarat,

*Ganvir*

( K. B. Pankhania )

Officer on Special Duty & Ex-Officio Deputy Secretary  
to the Govt. of Gujarat  
Urban Development and Urban Housing Department.

(૧) રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં તા. ૧૪-૯-૦૭ નાં જાહેરનામાથી પુનરાવર્તિત વિકાસ નિયંત્રણ નિયમોમાં થી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ ઝોનિંગ ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ-૧૯ હેઠળ વેરીએશન કરીને નિયમ નં. ૧૨.૩.૩ (બી) થી " પેઈડ એક.એસ.આઈ " ની નવી જોગવાઈ આમેજ કરવાનું ઠરાવેલ છે. સદરહુ નોટીફિકેશનની નકલ આ સાથે સામેલ છે.

ઉપરોક્ત મુજબની નવી આમેજ થયેલ " પેઈડ એક.એસ.આઈ " ની જોગવાઈમાં મહત્તમ મળવાપાત્ર એક.એસ.આઈ નો પુરેપુરો વપરાશ થઈ જતો હોવા છતાં, બિલ્ડીંગની મહત્તમ નિયત કરેલ ઉંચાઈ વપરાતી ન હોય, તેવા કિસ્સામાં મહત્તમ મળવાપાત્ર એક.એસ.આઈ નાં ૨૫% જેટલા વધારાના એક.એસ.આઈ નાં વપરાશ થી નીચે મુજબની વિગતોને આધિન પરવાનગી આપવાની જોગવાઈ થયેલ છે.

- (i) આવા વધારાનાં એક.એસ.આઈ નાં વપરાશ ની પરવાનગી પુનરાવર્તિત વિકાસ નિયંત્રણ નિયમો હેઠળ મંજૂર થયેલ બાંધકામો માટે જ આપવાની રહેશે.
- (ii) આવા વધારાનાં એક.એસ.આઈ નાં વપરાશ માટે બિલ્ડીંગ યુનીટ ૧૮.૦ મી કે તેથી વધુ પહોળાઈનાં રસ્તા ઉપર આવેલ હોવું જોઈશે.
- (iii) આવા વધારાનાં એક.એસ.આઈ નાં બાંધકામ માટે હયાત અને નવા બાંધકામનો સંબંધિત સત્તામંડળમાં રજીસ્ટ્રેશન પરવાનાર સ્ટ્રક્ચરલ એન્જીનીયરનો સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.
- (iv) આવા વધારાનાં એક.એસ.આઈ માટે Appropriate Authority પ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે દરે " Additional Infrastructure charge " ભરપાઈ કરવાનો રહેશે.

(૨) ઉપરોક્ત મુજબ વધારાનાં Additional Infrastructure charge " નાં દરો સુરત શહેરી વિકાસ સત્તા મંડળની તા. ૧૮-૬-૦૮ નાં રોજની બોર્ડ બેઠકનાં ઠરાવ નં. ૨૫૮૮ થી નક્કી કરવામાં આવેલ છે. સદરહુ ઠરાવની વિગતો નીચે મુજબ છે.

- (I) " Additional Infrastructure charge " બાંધકામ કરવાના વિસ્તારમાં જમીનના દરના ૨૦% પ્રમાણે દર ચો.મી વધારાના બાંધકામ ઉપર લેવાનો રહેશે; જ્યારે ઔદ્યોગિક બાંધકામના કિસ્સામાં જમીનના દરના ૨૫% પ્રમાણે દર ચો.મી વધારાના બાંધકામ ઉપર લેવાનો રહેશે. પરંતુ નગર રચના યોજના વિસ્તાર માટે ઓછામાં ઓછા રૂ. ૧૫૦૦/- પ્રતિ ચો.મી અને અન્ય વિસ્તારમાં ઓછામાં ઓછો રૂ. ૧૦૦૦/- પ્રતિ ચો.મી નો દર લેવાનો રહેશે.

- (ii) સરકારશ્રી ધ્વારા મંજૂર કરેલ અને જે તે સમયે અમલમાં હોય તે જંત્રી મુજબના જમીનના ભાવો લેવાના રહેશે તથા દર બે વર્ષે જમીનના ભાવ સંબંધિત સત્તામંડળ ધ્વારા રીવ્યુ કરવાના રહેશે.
- (iii) જ્યાં બે અલગ બિલ્ડીંગ યુનિટો એમાલગમેટ કરેલ હોય તેવા કિસ્સામાં જમીનનાં હિસ્સાના પ્રમાણસર મુલ્યાંકન કરી એફ.એસ.આઈ ના હેતુસર ધ્યાને લેવાનું રહેશે.
- (iv) વધારાના એફ.એસ.આઈ માટે વિકાસ દર, ચકાસણી ફી, સુવિધા ફી, મંજૂર વિકાસ નિયંત્રણ નિયમોની જોગવાઈઓ મુજબ સંબંધિત સત્તામંડળને ભરપાઈ કરવાની રહેશે.
- (v) જ્યાં હયાત બિલ્ડીંગ માટે વધારાનો એફ.એસ.આઈ ની પરવાનગી માંગેલ હોય તેમાં જમીન માલિક ધ્વારા સોસાયટીનું " ન વાંધા પ્રમાણપત્ર " મેળવવાનું રહેશે. આ જોગવાઈ જ્યાં બી.યુ.સી આપવામાં આવેલ હોય અથવા બાંધકામની વિકાસ પરવાનગી આપ્યાની તારીખથી ત્રણ વર્ષ હોય તેને લાગુ પાડવાનું રહેશે.
- (vi) કોઈ વહીવટી અથવા અન્ય કારણોસર કોઈ વિસ્તારને વધારાનો એફ.એસ.આઈ નો લાભ મળવાપાત્ર નથી તે અંગે નક્કી કરવામાં આવે તો સમુચિત સત્તામંડળ ધ્વારા જરૂરી કારણો સહિત નોંધ કરીને સદર વિસ્તારને જાહેર કરી શકાશે.
- (vii) પાર્કિંગ, ટ્રાફિક ઈસ્યુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરેના કારણે સમુચિત સત્તામંડળ અરજદારશ્રીની રજુઆત નામંજૂર કરી શકશે.

સુરત શહેરી વિકાસ સત્તામંડળનાં ઉપરોક્ત તા. ૧૮-૬-૦૮ નાં ઠરાવ નં. ૨૫૮૮ ની નકલ આ સાથે સામેલ છે.

મંજૂર થયેલ પુનરાવર્તિત વિકાસ નિયંત્રણ નિયમોમાં નવી આમેજ થયેલ વધારાનાં એફ.એસ.આઈ ની જોગવાઈનો ઉક્ત વિગતો ધ્યાને લઈને, તાત્કાલિક અસરથી અમલ કરવો.

બિડાણ:- ઉપર મુજબ

મુળપત્ર પર મે.કમિશનરશ્રીની સહી છે.

સહી/-

કમિશનર

સુરત મહાનગરપાલિકા

નં.ટી.ડી.ઓ./ ૨૪૩૦

તા. ૫/૦૯/૦૮

નકલ સ. રવાના :- ડાયરેક્ટર ઓફ પ્લાનીંગશ્રી પ્રતિ..... જાણ માટે.

નકલ સ. રવાના :- તમામ ઝોનનાં વિભાગીય વડાશ્રીઓ પ્રતિ..... જાણ માટે.

નકલ રવાના :- (૧) શહેર વિકાસ અધિકારીશ્રી પ્રતિ.... જાણ તથા તાત્કાલીક અમલ માટે.  
(૨) તમામ ઝોનલ અધિકારીશ્રી / કાર્યપાલક ઈજેનરશ્રી પ્રતિ.... જાણ તથા તાત્કાલીક અમલ માટે.

જોડા

ડાયરેક્ટર ઓફ પ્લાનીંગ  
સુરત મહાનગરપાલિકા

GOVERNMENT OF GUJARAT  
URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT  
SACHIVALAYA, GANDHINAGAR.

T D. O.  
Inward No. 2440  
Date. 2.9.07

NOTIFICATION  
Dated : 14-09-2007

29 SEP 2007  
[Signature]

THE GUJARAT TOWN PLANNING AND URBAN DEVELOPMENT ACT, 1976.

NO.GH/V/246 of 2007/DVP-1405-4305-L : WHEREAS, the Government of Gujarat was of the opinion that it was necessary, in the public interest, to make variations in the G.D.C.R. of revised Development Plan of Surat Urban Development Authority sanctioned under Government Notification, Urban Development and Urban Housing Department No.GH/V/100 of 2004/DVP-1403-3307-L, dated 02-09-2004. (hereinafter referred to as " the said G.D.C.R. of Development Plan " and " the said Authority " )

AND WHEREAS, the variations proposed to be made in the said G.D.C.R. of Development Plan were published, as required by the Section 19(1) of the Gujarat Town Planning and Urban Development Act, 1976 (President's Act No. 27 of 1976 ) (hereinafter referred as to " the said Act " ), in the Gujarat Government extra ordinary Gazette Part IV-B dated 22-03-2007 on page no.89/2-5 under Government Notification, Urban Development and Urban Housing Department No. GH/V/122 of of 2007/DVP-1405-4305-L dated 22-03-2007 along with a notice calling upon any person to submit suggestion or objection, if any, with respect to the proposed variations to the Principal Secretary to the Government of Gujarat. Urban Development and Urban Housing Department, Sachivalaya, Block No. 14, 9<sup>th</sup> Floor, Gandhinagar, in writing, within a period of two months from the date of publication of this notification in the official gazette.

AND WHEREAS, the Government of Gujarat has not received any suggestion or objection.

NOW THEREFORE, in exercise of the powers conferred by the section 19 of the said Act. The Government of Gujarat hereby :-

- (a) sanctions the said variations to be made in the said G.D.C.R. of Development Plan, as set out in Schedule appended here to and ;
- (b) specifies that the variation so set out shall come into force from the date of this notification;

SCHEDULE

Variations in the said G.D.C.R. of Development Plan of the said Authority sanctioned by Government Notification, Urban Development and Urban Housing Department No. GH/V/100 of 2004/DVP-1403-3307-L, dated 02-09-2004.

1. In regulation no. 2.42 at sub para no. (iii) words & figure "4 % of built up area" shall be deleted.
2. In regulation no. 2.42 after sub para no. (x) following new para no. (xi) shall be added "A canopy projecting in margins in such a way that minimum space of 2.3 mts from road side and 1.8 mts from side margin is left over"
3. In regulation no. 10.1 after the last line of 1<sup>st</sup> para the following words shall be added "However, the same provision may not applicable to the amalgamation of the plots which are amalgamated before this variations came into force".
4. In regulation no. 11.1 after words "no side less than 3.00 mts width" the following shall be added. "Provided however that this provision shall not apply to the plots reduce in area less than 18 sq. mts. by virtue of road alignment and the plots existing or sub divided and

[Signature]

MC/SMC  
29 SEP 2007

[Signatures]

AFK  
Suryajit  
Patel  
3/10

registered in City Survey Records or approved by any competent authority prior to dt.7-2-1980.

It is further provided that plots less than 18.00 sq.mt. in area allotted by SMC or Government agencies before coming into force of these regulation shall be considered as minimum plot for the purpose of this provision.

5. In regulation no. 11.6.3 in 2<sup>nd</sup> line figure "1.5 mt" is replaced by "1.0 mt."
6. After the existing provision in regulation no. 12.3.3 following provision shall be added as 12.3.3(B) In case of new construction, according to the provision of sanctioned revised development plan, where permissible height is not achieved even after consumption of permissible F.S.I. additional F.S.I. up to 25 % of permissible F.S.I. may be permitted subject to other provisions of the regulations.  
Provided that the building unit shall be abut on minimum 18.00 mts. wide road.  
Provided for such construction stability report shall be furnished for the existing and new construction by Authorised Structural Engineer.  
Above additional F.S.I. may be permitted on payment of an amount towards additional infrastructure charge at the rate decided by Appropriate Authority from time to time.
7. In the beginning of regulation no. 12.6 the following words and figure shall be added  
Not withstanding anything contained in Regulation No. 10 and 12, the following regulations shall apply for any building unit proposed to be developed for Row type building.
8. In regulation no. 16.1(i) in 1<sup>st</sup> line figure "30.00 mts." is replaced by "13.00 mts"
9. The new regulation no. 17 A shall be added as under.

17. A A REGULATION FOR EXISTING SLUM REDEVELOPMENT REHABILITATION SCHEMES ON SELF FINANCING BASIS.

17.A.1. DEFINITION OF SLUM

Slum means an Area which contains sheds. Huts constructed principally of wood mud, leaves grass, cloth or thatch and includes any temporary structures of whatever size and any small building of whatever material made, intended primarily for human habitation

17.A.2 DEVELOPMENT /REHABILITATION OF EXISTING SLUM:


These regulations shall apply to all building unit/lands/plots or part/portion of buildings units/lands/plots on which slums are existing as per the 2001 census as the case may be and /or plots being processed for slum upgradation. Redevelopment rehabilitation

- (1) Redevelopment of building units/lands/plots on which slums are existing as per the 2001 census shall be permitted for the rehabilitation of the slum dwellers through the owner of such land or their authorized agents/developers as approved by the Competent Authority by permitting redevelopment for slum dwellers.
- (2) All eligible slum dwellers residing on the building unit/land/plots to be redeveloped shall have to be accommodated on the same plot.
- (3) DP/TP Roads passing through and abutting on such building unit/plots may also be cleared by owners of such land by providing them accommodation in the scheme.

- 5
- (4) In any such scheme, area of existing commercial user shall be partitioned accordingly.
  - (5) The names of all eligible slum dwellers shall be verified and duly certified by the competent authority.
  - (6) Each hutment dweller personally (or his legal heir) residing as per record in 2001 census shall get the benefit or rehabilitation.
  - (7) The owners/authorized developers shall organize all the eligible hutment dwellers into a Registered co-op Housing Society/or a Registered Association.
  - (8) The Owners/Authorized developers shall grant a unit of minimum built up area of 20 sq. mts. subject to minimum 14.00 sq. mts. carpet area only in Low Rise buildings to each of the eligible slum dweller
  - (9) The 14.00 sq. mts carpet area of the dwelling unit shall include a multipurpose room cooking space and a w.c. but shall not include common area. Such as stairs passages etc. The rehabilitation unit shall be completed with water supply, drainage and electricity.
  - (10) The Permissible F.S.I. for the remaining plot shall be on the basis of Gross Building unit/plot/land area with addition F.S.I. of 0.50 of the F.S.I. consumed for eligible slum dwellers.
  - (11) Allotment and administration by lot system of new unit to all eligible slum dwellers, beneficiaries shall be done by the owner/developer/authorized agent.
  - (12) If in case it is necessary to shift some or all hutments dwellers to necessitate the new construction transit accommodation facility shall be offered by the owner/authorized developer at his cost and occupants shall have to vacate the slums and shall have to move to the transit accommodation.
  - (13) The Owners/authorized developers shall prepare a subdivision layout plan for the entire land occupied by the hutment dwellers, distinctly showing on the plan accommodations/buildings for eligible hutments/slums dwellers accommodations/buildings for commercial sale and submit plans and other documents as may be necessary to enable the Competent Authority to approve the subdivision plans and building plans for both.
  - (14) The Owners/authorized developers shall transfer the absolute ownership right free from all encumbrance in the proposed construction of rehabilitation until including their absolute rights in the part of land set apart for the rehabilitation to a registered co-op. Housing Society/Association of slums, hutments dwellers without any consideration. The owner/authorized developer shall have absolute rights of ownership of balance land and shall be entitled to develop such balance land.
  - (15) Possession and ownership of newly constructed unit for slum dweller under rehabilitation scheme shall be given only after the hutment dweller has relinquished all the right in original hut and the land bellow occupied by them as well as has peacefully handed over the possession of transit facility and paid all the dues. Each hutment dweller shall thus become virtual owner of his allotted dwelling unit through his membership of co-op. Society/Association.
  - (16) The allottee who has been given the rehabilitation unit shall not alienate the unit or transfer it to anybody else (Except the legal heirs) for a period of ten years from the date of taking over possession without prior permission of competent authority.
  - (17) The co-op. housing society/Association of the hutment dwellers at their cost shall manage and maintain the common facilities and amenities provided within the area transferred to the society/association and also shall be responsible for maintaining common amenities and services and also pay the Govt. and Municipal Taxes applicable from time to time.

- 6
- (18) The possession of the dwelling units in remaining building unit /land shall be permitted only after the completion and handing over the possession of rehabilitation dwelling units to all eligible slum dwellers.
- (19) The above regulations shall be subject to all other regulations of the GDCR and development plan and in case of any conflict between the above regulations and that of the GDCR and/or the Development plan the later shall prevail.
- (20) In case of slum rehabilitation project eligible slum dwellers agree upon to rehabilitate in other building unit/land. The complete project shall have to be approved by the Surat Municipal Corporation and Surat Urban Development Authority.

By order and in the name of the Governor of Gujarat,



( K. B. Pankhania )

Officer on Special Duty & Ex-Officio Deputy Secretary  
to the Govt. of Gujarat  
Urban Development and Urban Housing Department.

**Copy forwarded with compliments to :**

- ❖ The Chief Executive Officer , Surat Urban Development Authority, Surat.
- ✓❖ The Municipal Commissioner, Surat Municipal Corporation, Surat.
- ❖ The Chief Town Planner, Gujarat State, Gandhinagar.
- ❖ The Senior Town Planner, South Gujarat Region, Kuber Bhavan, I-Block, 8<sup>th</sup> Floor, Room No. 802, Kothi Compaound, Baroda.
- ❖ The Collector, Surat. Dist. Surat.
- ❖ The District Development Officer Surat. Dist. Surat.
- ❖ The Manager, Government Central Press, Gandhinagar - With a request to publish the aforesaid notification in Part IV-B central Section, in the Gujarat Government Extra Ordinary Gazette of 14/09-2007 and forward 10 printed copies of the same to this department. The Gujarati version of the Notification will be forwarded shortly to you by the Legislative and Parliamentary Affairs Department, Sachivalaya, Gandhinagar.
- ❖ The Legislative and Parliamentary Affairs Department, Sachivalaya, Gandhinagar - with request to send Gujarati version of the said Notification directly to the Manager, Government Central Press, Gandhinagar for its publication in the official gazette urgently.
- ❖ The Director of Information, Gandhinagar- with request to issue a suitable press note.
- ❖ The Revenue Department, New Sachivalaya, Gandhinagar.
- ❖ The P.S. to Hon'ble Minister (U. D. & U. H. D) New Sachivalaya, Gandhinagar.
- ❖ System Manager, Urban Development and Urban Housing Department, Gandhinagar- with request to publish in the department web site.
- ❖ The Select file of ' L ' Branch, U. D. & U. H. D. (2007)
- ❖ The personal file of Dy. Section Officer, U. D. & U. H. D. (2007)